

ભૌતિક સુખ-સુવિધા પાછળ ગાંડા ન થવું

જે પરિવારના મોભી પોતાના ઘરના સભ્યોની ભૌતિક માગણીઓને પુરી કરવાને જ પોતાની ફરજ સમજતા હોય અને તેને પૂરી પણ કરતા હોય તો તેમણે ભવિષ્યનાં ખતરનાક પરિણામો માટે તૈયાર રહેવું જોઈએ. ભૌતિક સુખ-સુવિધાઓનો સીધો સંબંધ શરીર સાથે હોય છે. આજની આધુનિક જીવનશૈલીમાં લોકોને ભૌતિક સુખ-સુવિધા વગર ચાલતું નથી. આપણું સમગ્ર ધ્યાન તે જરૂરિયાતો પૂરી કરવામાં લાગી જાય છે.

મકાન, ગાડી, ટીવી, ફ્લર, એસી બધું જ પોતાના હિસાબે મોટા બંગલાથી માંડીને નાની ઝૂંપડી સુધીમાં જોવા મળે છે, પરંતુ ત્યાર બાદ પણ શાંતિની બાબતે ગરીબાઈ યથાવત્ રહે છે. ફકીકતમાં આપણે શરીર પર એટલા આધારિત થઈ ગયા છીએ કે મન નામની અમરવેલને જ ભૂલી ગયા છીએ. અમરવેલ એટલે તેવો વેલો જે આડ સાથે જોડાઈ જાય, તેને ચૂસી લે છે, જેને પરિણામે આખું આડ સૂકાઈ જાય છે. વેલો ફળ-ફૂલ ખાઈ જાય છે.

મનના ફેલાવાનું નામ જ જીવનની બેચેની છે. આપણે પોતાના ઉત્તરાધિકારીઓ માટે સંપત્તિ છોડીએ છીએ, પરંતુ અસલ જવાબદારી ભૂલી જઈએ છીએ. મનુષ્યને મશીન માનીને તેમાં તેલ-પાણીની જેમ ભૌતિક સુવિધાઓ આપતા જઈએ છીએ. માણસની અંદર જે ચેતના છે તેને સ્પર્શ કરવામાં પરિવારનો મોભી ચૂકી જાય છે. બધા જ સભ્યો બહારની સુવિધાઓથી એટલા ટેવાઈ જાય છે કે તેમાં થોડી ઘણી પણ કમી આવે તો બધા એક-બીજા પર આગ ઓકવા લાગે છે.

સંસારી વૈકુંઠમાં સ્થાન પામવાની સંભાવના જ સમાપ્ત થવા લાગે છે. આથી પરિવારમાં જ્યારે પણ જે કોઈ મોભીની ભૂમિકામાં હોય તેણે સભ્યોના મનમાં પહોંચવું જોઈએ, જે જીવનઉર્જાના મનને ખાઈ રહ્યું છે તેને રોકવું. તન-મનના સંતુલનને સમજનારા પરિવાર શાંતિના કેન્દ્ર બને છે.

Dinesh-Vadasan
9377209292

BACK to



www.vadwala.com